

કલમ – ૪ (૧)(બી) (૨):– સંસ્થાના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો

જાહેર તંત્રની વિગત :-

શહેરી પ્રજાજનોને આગ અક્ષમાત સમયે બચાવ કામગીરી તથા જરૂરી ફાયર ફાઈટિંગ સુવિધા તેમજ કુદરતી હોનારતો જેવી કે ઘરતીકંપ /વાવાઝોડા સાથે વરસાદ થતા પુર જેવી હોનારતોમાં રાહત તેમજ બચાવની કામગીરી પુરી પાડવાની અને જરૂરીયાત મંદોને તેઓની માંગણીનુસાર એભ્યુલન્સ/ શબદાહીની સેવાઓ પુરી પાડવી.

જનસેવાઓ અંગેની ફરીયાદ અને નિવારણની વ્યવસ્થા :-

ફાયરકંટ્રોલરૂમ રાઉન્ડ ધ કલોક ફરજ બજાવે છે.

મુખ્ય કચેરી અને ફાયર સ્ટેશનોની વિગત :-

સુરત મહાનગરપાલિકા, ગોરધનદાસ ચોખાવાળા માર્ગ, મુગલીસરા, સુરત-૩૯૫૦૦૩.

અનું.	ફાયર સ્ટેશનોનું નામ
૧	માનદરવાજા ફાયર સ્ટેશન.
૨	હુંબાલ ફાયર સ્ટેશન.
૩	વરાણા ફાયર સ્ટેશન.
૪	મજૂરા ફાયર સ્ટેશન.
૫	ભેસ્તાન ફાયર સ્ટેશન.
૬	નવસારી બજાર ફાયર સ્ટેશન.
૭	ધાંચી શેરી ફાયર સ્ટેશન.
૮	મુગલીસરા ફાયર સ્ટેશન.
૯	કતારગામ ફાયર સ્ટેશન.
૧૦	કોસાડ ફાયર સ્ટેશન.
૧૧	મોરાબાગળ ફાયર સ્ટેશન.
૧૨	અડાજણા ફાયર સ્ટેશન.
૧૩	મોટાવરાણા ફાયર સ્ટેશન
૧૪	પાલનપુર ફાયર સ્ટેશન
૧૫	ડાઢોલી ફાયર સ્ટેશન
૧૬	વેસુ ફાયર સ્ટેશન
૧૭	પૂણા ફાયર સ્ટેશન
૧૮	ડાઢોલી ફાયર સ્ટેશન
૧૯	સરથાણા ફાયર સ્ટેશન
૨૦	ઉધના રોડ -૩ ફાયર સ્ટેશન
૨૧	ઇ. આર. સી. (કામરેજ)

કાર્યાલયનો ખુલવાનો સમય અને બંધ થવાનો સમય :-

- (અ) ફાયરકંટ્રોલરૂમ રાઉન્ડ ધ કલોક ખુલ્લો રહેશે.
(બ) વહીવટી કાર્યાલય સવારે ૧૦-૩૦ કલાકથી સાંજે ૬-૧૦ કલાક
(બીજો/ ચોથો શનિવાર, રવિવાર તથા જાહેર રજાનાં દિવસો કિંવાય.)

જાહેરતંત્રનો ઉદ્દેશ/હેતુ

સુરત મ.ન.પા.નાં વહીવટી તંત્રને અસરકારક અને ઉત્તરદાયી બનાવવા સરકારશ્રીનાં પ્રજાલક્ષી ધ્યયને સ્વરૂપ આપવા શહેરની પ્રજાને નાગરિક સુવિધા પુરી પાડવાનો ઉદ્દેશ રહેલો છે.

જાહેરતંત્રનું મિશન / દુરંદેશીપણું

શહેરી પ્રજાજનોને આગ અક્સમાત સમયે બચાવ કામગીરી તથા જરૂરી ફાયર ફાઈટિંગ સુવિધા તેમજ કુદરતી હોનારતો જેવી કે ઘરતીકિપ /વાવાળોડા સાથે વરસાદ તથા પુર જેવી હોનારતોમાં રાહત તેમજ બચાવની કામગીરી પુરી પાડવાની અને જરૂરીયાત મંદોને તેઓની ભાંગણીનુસાર એભ્યુલન્સ/ શબવાહીની સેવાઓ પુરી પાડવી.

ફાયર ખાતાની મુખ્ય કામગીરીઓ નીચે મુજબ છે.

- ૧ ફાયર કંટ્રોલરૂમ કે ફાયર સ્ટેશન ખાતે જાણ કર્યોથી આગ ઓલવવાની તથા બચાવ કામગીરી કરવામાં આવે છે. વધુમાં માનવ સર્જિત હોનારતો કે કુદરત નિર્ભિત હોનારતોમાં આગ અક્સમાત બચાવ વિગેરેની કામગીરી કરવામાં આવે છે.
- ૨ ઈમારતના સંચાલકી ધ્વારા તેઓની ઈમારતમાં ફાયર ફાઈટિંગ સુવિધાઓ ઉલ્લી કરી અતે લેખિત અરજી કરી કે શહેર વિકાસ વિભાગ મારફતે અતે જાણ કરવા આવી ઈમારતની ઉલ્લી કરવામાં આવેલ ફાયર ફાઈટિંગ સુવિધાની ચકાસણીની કામગીરી.
- ૩ શહેરી વિસ્તારમાં આવેલ સીનેમાગુંડો તેમજ થીયેટરમાં ફાયર ફાઈટિંગ સુવિધાઓ ઉલ્લી કરાયા બાદ મેનેજમેન્ટ ધ્વારા અતે લેખિતમાં જાણ કરતા આવી ઈમારતની ઉલ્લી કરવામાં આવેલ ફાયર ફાઈટિંગ સુવિધાની ચકાસણીની કામગીરી.
- ૪ પ્રદર્શનનો, ધાર્મિક સંમેલનો, સમુહલગ્ન સમારંભો, મેળાઓ, ફટાકડાનાં બુથો જેવા હંગામી ધોરણે ઉભા કરવામાં આવેલ પંડાલનાં ઈન્સ્પેક્શન, પંડાલ ખાતે ઉલ્લી કરવામાં આવેલ ફાયર ફાઈટિંગ સુવિધાઓની ચકાસણી અર્થ અતે સંસ્થાના સંચાલકશીઓ ધ્વારા જાણ કરવામાં આવતા આવા સ્થળો ખાતે ઉલ્લી કરવામાં આવેલ ફાયર ફાઈટિંગ સુવિધાની ચકાસણીની કામગીરી.
- ૫ પોલીસ વિભાગ ધ્વારા શહેરની મુલાકાતે આવતા મહાનુભાવોનાં પ્રવાસ કાર્યક્રમ દરમ્યાન બંદોબસ્ત પુરો પાડવાની ભાંગણી કરતા આવા મહાનુભાવોને ફાયર બંદોબસ્ત આપવાની કામગીરી.
- ૬ જે તે સંસ્થા કે શાળા મેનેજમેન્ટ ધ્વારા પોતાની શૈક્ષણિક સંસ્થાઓમાં ઉલ્લી કરવામાં આવેલ ફાયર ફાઈટિંગ સુવિધાઓની ચકાસણી કરવા અતે અરજી કરતા આવી સંસ્થાની ફાઈટિંગ સુવિધાની ચકાસણીની કામગીરી. શાળાના સંચાલકશીઓ ધ્વારા, સરકારશીના કાર્યક્રમ નિભિતે તેમજ અતેથી નકદી થયેલ કાર્યક્રમ મુજબ જે તે શાળાઓના વિધાર્થીઓને આપત્તિ સમયે સ્બબચાવની તેમજ અન્યોને બચાવવાની કામગીરી કરી રહેતે કરવી તે અંગે અવેરનેસનું ગ્રધિકાર આપવાની કામગીરી.
- ૭ જે તે સંસ્થાના સંચાલકશી ધ્વારા, સરકારશીના કાર્યક્રમ નિભિતે તેમજ અતેથી નકદી થયેલ કાર્યક્રમ મુજબ જે તે વર્ડવાર જનજાગૃતિના તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં, ઓધોગિક સંકુલો, કામદાર સંસ્થાઓ, હોમગાર્ડ્સ, નાગરિક સંરક્ષકો, વિગેરે માટે અવેરનેશ કાર્યક્રમો યોજવાની અને આમજનતાને ફાયર ફાઈટિંગ તેમજ બચાવની અને અવેરનેશની તાલીમ આપવાની કામગીરી.
- ૮ સક્ષમ સત્તાની મંજૂરી અન્વયે ઉચ્ચાધિકારીશી તેમજ પદાધિકારીશીઓને ઉપરાંત ભ.ન.પા.અન્ય વિભાગોને કોમનપુલનાં વાહનોની વ્યવસ્થા પુરી પાડવાની તેમજ મહાનગરપાલિકાની તમામ કચેરીઓમાં સંદેશ વ્યવહારનાં સાથનો પુરા પાડવાની કામગીરી.
- ૯ આમ જનતા ધ્વારા ભાંગણી કર્યોથી ઉપલબ્ધ એભ્યુલન્સ તેમજ શબવાહીનીની સુવિધા પુરી પાડવા અંગેની કામગીરી.
- ૧૦ અનિનશમન વિભાગ તરફથી ફાયર વોલીયન્ટર માટે સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર નામ રજીસ્ટ્રેશન કર્યો જે તે વ્યકિતને, સરકારી તેમજ બિનસરકારી સંસ્થાનાં કર્મચારીઓ, ખાનગી એકમોના કોઠીપણ વ્યકિતને વિનામૂલ્યે ફાયરની તાલીમ આપવામાં આવે છે.

એડી.ચીફ ફાયર ઓફિસર :-

ફાયર ખાતાનો તમામ પ્રકારનો ઓપરેશનથી તેમજ વહીવટી વડા તરીકેનો ચાર્જ ચીફ ફાયર ઓફિસર સંભાળવાનો રહેશે.

ચીફ શાયર ઓફિસરે વિભાગીય વડાની દેખરેખ હેઠળ અને વિભાગીય વડા તેમજ કમિશનરી જે ખાતાકીય ફરજ તેમજ જવાબદારી સોપે તે ફરજ તેમજ જવાબદારી નિભાવવાની રહેશે.

- ૧ મહાનગરપાલિકાએ નિયત કરેલ યુનિફર્મ ઓફિસ સમયમાં પહેરવાનો રહેશે.
- ૨ શાયરખાતાની ઓપરેશનલ ફરજો ઉપરાંત અન્ય સંસ્થાઓ સાથે પત્રવહાર, ખાતાકીય ફરીયાદોનો નિકાલ, ખાતાને લગતી જરૂરી સાધનસામગ્રી ખરીદીએ, ખાતાકીય રજીસ્ટરોનું અવારનવાર ચેકીંગ કરવું, શાયર સ્ટેશનની અચાનક મુલાકાત લેવી વિગેરે વહીવટી ફરજો બજાવવાની રહેશે.
- ૩ ચીફ શાયર ઓફિસરે મહીનામાં ઓછામાં ઓછું બે વાર પરેડનું આકસ્મીક નિરીક્ષણ કરવાનું રહેશે.
- ૪ ચીફ શાયર ઓફિસર વિભાગીય વડાની પૂર્વ મંજુરી સિવાય પોતાની ફરજ માંથી મુક્ત થઈ શકશે નહીં.
- ૫ સુરત મહાનગરપાલિકા નાં શાયર બ્રિગેડ ખાતા હસ્તકનાં ટ્રેનિંગ સેન્ટરમાં ખાતાનાં કર્મચારીઓ તેમજ અન્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ માટે વિવિધ તાલીમ ના કાર્યક્રમોનું આયોજન તેમજ સંકલન કરવાનું રહેશે.

દેખ્યુટી ચીફ શાયર ઓફિસર :-

શાયર ખાતામાં ચીફ શાયર ઓફિસરે ખાતાના વડા (ચીફ શાયર ઓફિસર) ની સીધી દેખરેખ હેઠળ ફરજ બજાવવાની રહેશે.

- ૧ મહાનગરપાલિકાએ નિયત કરેલ યુનિફર્મ ઓફિસ સમયમાં પહેરવાનો રહેશે.
- ૨ ખાતાનાં તમામ સ્ટોક રજીસ્ટર, ડેઝસ્ટોક રજીસ્ટરો, મેઇનટેઇન કરવાનાં રહેશે. શાયરખાતાનો સ્ટોર્સ તેમની સીધી દેખરેખ હેઠળ રહેશે.
- ૩ ખાતાના ઓપરેશનલ ફરજો ઉપરાંત અન્ય સંસ્થાઓ સાથે પત્ર વહાર, ખાતાકીય ફરીયાદોનો નિકાલ, ડીવીઝનલ ઓફિસર કક્ષા સુધીના તમામ કર્મચારીઓની માંદગીની રજા, પ્રાપ્ત રજા, જાહેરતહેવારની રજા મંજૂર કરવી, ખાતાના વાહનો માટે જરૂરી સાધન સામગ્રી ખરીદીએ, ખાતાકીય રજીસ્ટરોનું અવારનવાર ચેકીંગ કરવું, શાયર સ્ટેશનની અચાનક મુલાકાત લેવી વિગેરે વહીવટી ફરજો બજાવવાની રહેશે.
- ૪ ચીફ શાયર ઓફિસરે અઠવાડીયામાં ઓછામાં ઓછું ત્રણ વાર પરેડનું આકસ્મીક નિરીક્ષણ કરવાનું રહેશે.
- ૫ ચીફ શાયર ઓફિસર ખાતાના વડા અથવા તો વિભાગીય વડાની પૂર્વ મંજુરી સિવાય પોતાની ફરજ માંથી મુક્ત થઈ શકશે નહીં.
- ૬ શાયરબ્રિગેડ ખાતાનાં ટ્રેનિંગ સેન્ટરમાં તાલીમ લેવા આવતા તાલીમાંથી માટે તાલીમનો માસિક કાર્યક્રમ તૈયાર કરવો તેમજ ખાતાના કર્મચારીઓ માટે પરેડનો માસિક કાર્યક્રમ તૈયાર કરવો અને તેની નકલ ચીફ શાયર ઓફિસર તેમજ વિભાગીય વડા ને જાણ માટે રજુ કરવાની રહેશે
- ૭ શહેરમાં આવેલ બહુમાળી મકાનો, સીનેમાગૃહો, સરકસ, પ્રદર્શન/ મેળા વિગેરે સ્થળોની ચકાસણી કરી જે તે જગ્યા માટે જરૂરી શાયર ફાઈટીંગ સુવિધા ઉભી કરવા અંગેના રીપોર્ટ રજુ કરવાના તેમજ આવી સુવિધા ધરાવતી જગ્યાઓના સ્થળ નિરીક્ષણ કરી વખતો વખતો સુધારા વધારા સુચવવાના અને તે અંગે ની જાણ ચીફ શાયર ઓફિસરને કરવી.

ડીવીઝનલ ઓફિસર (શાયર) :-

- ૧ દરેક ડીવીઝનલ ઓફિસર શાયરખાતાએ નક્કી કરેલ શાયર સ્ટેશનનાં ડીવીઝનના વડા તરીકે ફરજ બજાવશે અને પોતાના તાથા હેઠળના તમામ શાયર સ્ટેશનના શાયર ઓફિસર, સબ ઓફિસર, જમાદાર, પ્રાઇવર-કમ-પંપ-ઓપરેટર,

શાયરમેન, શબ્દવાળીની કર્તૃનાર ઉપર ખાતાકીય ફરજો અંગે નિયંત્રણ રાખશે.

- ૨ દરેક ડીવીજનલ ઓફિસરે કચરાની આગ સિવાયનાં દરેક કોલમાં તેમજ મકાન હોનારત કે અન્ય બચાવ કોલ કે જેમાં કોઈ વ્યક્તિની જાનનું જોખમ હોય તેવા તમામ કોલમાં ફરજીયાત જવાનું રહેશે.
આ અંગે શાયર ખાતાની જીપની ઉપલબ્ધ ના હોય તો તેવા સંજીવોમાં એમ્બ્યુલન્સ અથવા અન્ય કોઈ વાહનનો ઉપયોગ કરવાનો રહેશે.
- ૩ પોતાના ડીવીજનનાં શાયર ઓફિસર સહીત તમામ ઉત્તરતી કક્ષાનાં કર્મચારીઓની ટુંકી રજા સવલત મુજબ મંજુર કરવાની રહેશે. જ્યારે(શાયર ઓફિસર, સબ-ઓફિસર) ડ્રાઇવર-કમ-પંપ ઓપરેટર, જમાદારની દિન -૭ સુધીની કેઝ્યુલ રજા સવલતતા મુજબ મંજુર કરવાની સત્તા ધરાવશે.
- ૪ દરેક ડીવીજનલ ઓફિસરે પોતાના ડીવીજનનાં તમામ શાયર સ્ટેશનોનું વહીવટી સંચાલન કરવાનું રહેશે. અને તેમાં જો કોઈ નુટી કે ક્ષતિ જાણાય તો તેની લેખિત જાણ અનુકૂલે ડે.ચીફ શાયર ઓફિ.તેમજ ચીફ શાયર ઓફિસરને કરવાની રહેશે.
- ૫ પોતાના તાબા હેઠળના શાયર સ્ટેશનો ઉપરના વિવિધ રજીસ્ટરો જેવા કે ટેડસ્ટોક, સ્ટોક, પેટ્રોલ,ડીજલ, લોગબુક, ડ્યુટીબુક, અકરન્સ બુક વિગેરે નિયમિત મેઈનટેઇન થાય છે કે કેમ તેનું આકસ્મીક ચેકીંગ કરવાનું તેમજ વાહનોનું અને સાધનોનું પણ આકસ્મીક ચેકીંગ તેમજ ટેસ્ટીંગ કરવાનું રહેશે.
- ૫.૧ અને શાયર સ્ટેશનોમાં ફરજ ઉપરનાં જે કર્મચારીની ફરજ પ્રત્યેની બેદરકારી અથવા ઉપેક્ષા જાણાય તો જે તે સંબંધિત કર્મચારીને વધુમાં વધુ દિન-૦૫ (પાંચ) સુધીની ગાર્ડ ડ્યુટી શિક્ષાત્મક પગલાડુધે આપવાની રહેશે.
- ૬ દરેક ડીવીજનલ ઓફિસરે ખાતાની પરેડમાં નિયમિત પણે હાજર થવાનું રહેશે.
- ૭ દરેક ડીવીજનલ ઓફિસરે ડે.ચીફ શાયર ઓફિસર કે ચીફ શાયર ઓફિસરની પુર્વમંજુરી વિના પોતાની ફરજમાંથી મુક્ત થવું નહીં તેમજ તે બાબતની મંજુરી મળ્યેથી કંટ્રોલ ને તે બાબતની જાણ કર્યા બાદ ફરજ માંથી મુક્ત થવું ફરજ દરમ્યાન મહાનગરપાલિકા તરફથી ક્ષાળવવામાં આવેલ ગણવેશ અચુક પહેરવાનો રહેશે.
- ૭.૧ દરેક ડીવીજનલ ઓફિસરે ડે.ચીફ શાયર ઓફિસર કે ચીફ શાયર ઓફિ.ની પુર્વમંજુરી વગર શાયર સ્ટેશન છોડવું નહીં.
- ૭.૨ જે ડીવીજનલ ઓફિસરનાં ચાર્જમાં હેડ કવાર્ટ્સ હોય તેમણે મોડામાં મોડા દર મંગળવારે આગળના અઠવાડિયાનાં અઠવાડિક લેખિત રીપોર્ટ ડે.ચીફ શાયર ઓફિસર મારક્ષત ચીફ શાયર ઓફિસર ને રજુ કરવાના રહેશે.
આ ઉપરાંત આગ/અથવા કોલના પ્રમાણપત્ર તૈયાર કરવાના અને વાર્ષિક વહીવટી અહેવાલ તૈયાર કરવાના રહેશે.
- ૮ શાયરખાતાનાં હક્સટકની ક્લેઇન, હાઈસ્ટ્રોલિક પ્લેટફોર્મ, ડી.સી.પી. ટેન્ડર જેવા અતિ આધુનિક સાધનો જેતે ડીવીજનનાં ડીવીજનલ ઓફિસરોની સીધી દેખરેખ હેઠળ રહેશે. જરૂર પણે આવા સાધનોનાં ઉપયોગ, રીપેરીંગ વિગેરે બાબતે તેઓને ઉપરી અધિકારીનું માર્ગદર્શન મેળવી તે મુજબ કામ કરવાનું રહેશે.
- ૯ આ ઉપરાંત તમામ ડીવીજનલ ઓફિસરોએ ખાતાનાં ડે.ચીફ શાયર ઓફિસર અથવા તો તેનાથી ઉપરી કક્ષાના અધિકારીઓ જે ખાતાકીય ફરજ સોધે તે ફરજ બજાવવાની રહેશે.

કાયર ઓફિસર :-

- ૧ દરેક શાયર ઓફિસરે તેમની જે સ્ટેશન ઉપર નિમણૂંક તેમજ બદલી કરવામાં આવેલ હોય તે સ્ટેશન ઉપર પોતાના

ડીવીજનલ ઓફિસર કે તેનાથી ઉચ્ચકક્ષાના અધિકારીઓના આદેશ મુજબ ૨૪ કલાક ખાતાકીય કામગીરી બજાવવાની રહેશે

- ૨ પોતે ફાયર સ્ટેશન ઉપર હાજર હોય ત્યારે હાજરીના તેમજ વર્કિંગના સમયમાં ફાયર સ્ટેશનના પોતાના તાબા હેઠળના કર્મચારીઓની કામગીરીનું આયોજન કરવાનું રહેશે.
- ૨.૧ આ ઉપરાંત પોતાના તાબા હેઠળના કર્મચારીઓ ફરજમાં બેદરકાર જણાય તો શિક્ષાત્મક પગલારૂપે વધુમાં વધુ દિન-૦૩ ની ગાર્ડ ડયુટી આપવાની રહેશે.
- ૩ પોતાના તાબા હેઠળના સબ ઓફિસર કે જમાદાર અન્ય કર્મચારીઓ પાસેથી વ્યવસ્થિત રીતે કામગીરી લે તે મુજબની વ્યવસ્થા કરવાની રહેશે. અને તેમને જરૂરી માર્ગદર્શન આપવાનું રહેશે.
- ૪ દરેક ફાયર ઓફિસરે પોતાના ફાયર સ્ટેશનને મળતા (કચરાની આગ સિવાયના દરેક આગના કોલમાં તેમજ મકાન હોનારત કે અન્ય બચાવકોલ કે જેમાં કોઈ વ્યક્તિની જ્ઞાન જોખમમાં હોય તેવા) આગ અકસ્માતના દરેક કોલમાં ફરજીયાત જવાનું રહેશે.
- ૫ દરેક ફાયર ઓફિસરે ફરજ દરમ્યાન મહાનગરપાલિકા તરફથી ફાળવવામાં આવેલ ગણવેશ અચુક પહેરવાનો રહેશે. તેમજ પોતાનાથી ઉત્તરતી કક્ષાના કર્મચારીઓ પાસેથી ગણવેશ અંગે આગ્રહ રાખવાનો રહેશે.
- ૬ પોતાના તાબા હેઠળના ફાયર સ્ટેશનનાં વાહનો તેમજ અન્ય સાધનો, ડેડ સ્ટોક આર્ટીકલ, લોન આર્ટીકલ, સ્ટોક આર્ટીકલોની નોંધ દરેક ફાયર ઓફિસરે રાખવાની તેમજ તે અંગે જરૂરી રજીસ્ટરો મેઇન્ટેનન કરવાનાં રહેશે.
- ૭ પોતાના તાબા હેઠળના સ્ટેશન વિસ્તારના ફાયર હાઈફ્લાન્નનું ચેકીંગ કરવા કરાવવા સબ ઓફિસર, જમાદાર, ફાયરમેનને આદેશ આપશે અને તેનું અચુક પાલન થાય તે મુજબ નિરીક્ષણ કરશે.
- ૮ દરેક ફાયર ઓફિસરે પોતાના તાબા હેઠળનાં સ્ટેશનનાં પોતાનાથી ઉત્તરતી કક્ષાના તમામ કર્મચારીઓની ટુંકી રજાઓ સવલત મુજબ મંજૂર કરવાની રહેશે. તેમજ ફાયરમેન અને શબ્દવાહીની કલીનર ની દિન-૦૩ (ત્રણ) સુધીની કેઝ્યુલ રજા સવલતતા મુજબ મંજૂર કરવાની સત્તા ધરાવશે.
- ૮.૧ ફાયર ઓફિસરે પોતાના તાબા હેઠળ નાં કર્મચારીઓની દિન-૦૩ ની સી.એ.લ. મંજૂર કરવાનું રહેશે.
- ૮.૨ આ ઉપરાંત તમામ ફાયર ઓફિસરે ડીવીજનલ ઓફિસર કે તેનાથી ઉપરી કક્ષાના અધિકારીઓ જે ખાતાકીય ફરજ સોએ તે ફરજ બજાવવાની રહેશે.
- ૯ દરેક ફાયર ઓફિસરે ઉપરી અધિકારીની મંજૂરી મેળવ્યા વિના ફાયર સ્ટેશન છોડવાનું નહીં. અને તે મુજબની મંજૂરી મળ્યેથી સબ ઓફિસર અથવા તો જમાદારને તેમજ કંટ્રોલરુમને તે બાબતની જાણ કર્યા બાદ ફાયર સ્ટેશન છોડવાનું રહેશે.
- ૧૦ પોતાના તાબા હેઠળના ફાયર સ્ટેશનના પોતાનાથી ઉત્તરતી કક્ષાના કર્મચારીઓની સાથે જરૂરી ગણવેશમાં ઉપરી અધિકારી વખતો વખત સૂચયે તે મુજબ પરેડમાં હાજર થવાનું રહેશે. અને પોતાના કક્ષાની સમકક્ષ અધિકારીઓ સાથે પરસ્પર સમજૂતી થી પરેડનું સંચાલન કરવાનું રહેશે.
- ૧૧ સબ-ઓફિસર / જમાદાર તરફથી કરવામાં આવેલ બેરીયત રીપોર્ટ કંટ્રોલને તેમજ ઉપરી અધિકારીને સાદર કરવાનો રહેશે.
- ૧૨ દરેક ફાયર ઓફિસરે પોતાના તાબા હેઠળ રાખવામાં આવેલ તમામ વાહનો તેમજ સાધનોનું નિયમિત ટેસ્ટીંગ કરવાનું રહેશે અને તેના કાર્યમાં નૃટિ કે ક્ષતિ જણાય તો તેની લેખિત જાણ ઉપરી અધિકારીને કરવાની રહેશે.

સબ ઓફિસર(ફાયર) :-

- ૧ સબ ઓફિસર તરીક નિમણુંક પામેલ કર્મચારીએ પોતાની નિમણુંક તેમજ બદલી જે ફાયર સ્ટેશન ઉપર કરવામાં આવેલ હોય તે સ્ટેશનના ફાયર ઓફિસરની સીધી દેખરેખ હેઠળ ચોવીસ કલાક ખાતાકીય ફરજ બજાવવાની રહેશે. તેમજ જેસે

- स्टेशनना शायर ओझीसर के तेना करतां । उच्च कक्षानां शायर खाताना अन्य अधिकारीना आदेश मुजब खाताकीय फृज बजाववानी रहेशे. वधुमां शायर ओझीसरनी अनुपस्थितिमां शायर स्टेशननो संपुर्ण चार्ज तेमना ताबा हेठला रहेशे.
- २ दरेक सब ओझीसरे पोताना ताबा हेठलानां कर्मचारी जेवा के ड्राईवर -कम-पंप- ओपरेटर, जमादार, शायरमेन, शबवाढीनी कल्पनर, विग्रेनी डैनिक फृजो रोजबरोज नक्की करवानी रहेशे. अने तेवा कर्मचारीओ पोतानी फृजनु पालन सुव्यवस्थित करे ते मुजबनी नोंध राखवानी रहेशे.
 - ३ दरेक सब-ओझीसरे शायर स्टेशनमां पोते हाजर होय ते दरेक शायर स्टेशनने भगेल दरेक आग अकस्मातना कोलमां भ.न.पा. तरक्थी फाणववामां आवेल गङ्गावेश साथे फृजीयातपछे जवानु रहेशे.
 - ४ दरेक सब-ओझीसरे पोताना ताबा हेठलाना कर्मचारीओ हाजरीना सभये तेमज वर्किंगना सभये नियमित हाजर थई पोतानी कामगीरी व्यवस्थित बजावे छे के तेनु निरीक्षण करवानु रहेशे. अने जो तेमां कोई क्षति मालुम पडे तो पोताना उपरी अधिकारीने लेखित जाष करवानी रहेशे.
 - ५ पोताना ताबा हेठलाना शायर स्टेशन उपर राखवामां आवेल दरेक वाहनो तेमज साधनोनु नियमित चेकीग करवानु रहेशे जो कोई साधन के वाहनमां क्षति अथवा तुटेल ज़खाय तो तेवा साधन अथवा वाहनने तात्कालिक रीपेर कराववा अथवा जे भेगववा अंगे उपरी अधिकारीने लेखित रीपोर्ट करवानो रहेशे. तेमज दरेक वाहनोनी लोगबुक व्यवस्थित भरावी ऐन्ट्रीओनु खरापणु करवानु रहेशे.
 - ६ दरेक सब-ओझीसरे पोताना स्टेशन उपरना पोतानाथी उतरती कक्षाना तमाम कर्मचारीओनी टुक्की २४ सवलत प्रभाषे भंजुर करवानी रहेशे.
 - ७ दरेक सब ओझीसरे पोतानाथी उतरती कक्षाना कर्मचारीओ साथे क्लम नियत कर्च मुजब परेडमां हाजर थई परेड करवानी रहेशे.
 - ८ दरेक सब ओझीसरे पोताना ओझीस फृज, आग अकस्मातनाकोला भां तेमज अन्य खास फृजोमां भ.न.पा. तरक्थी फाणववामां आवेल गङ्गावेश पहेरवानो रहेशे. तेमज पोतानाथी उतरती कक्षाना कर्मचारीओ पासे सदर बाबतनु पालन कराववानु रहेशे.
 - ९० दरेक सब-ओझीसरे पोताना ताबा हेठलाना नोनकमिशन वाहनोनी डैनिक नोंध तेमज गेरहाजर कर्मचारीओनी विगतवार यादी (भेरीयत रीपोर्ट) रोजबरोज शायरभातानां कंट्रोलरुमने तेमज उपरी अधिकारीने सादर करवानो रहेशे.
 - ११ प्रसंगोपात शायर स्टेशन छोडवानो प्रश्न उबो थाय अथवा टुक्की २४ उपर जवानो प्रसंग उबो थाय तेवा संजोगोमां शायर ओझीसर के तेनाथी उच्चकक्षाना अधिकारीनी भंजुरी लेवानी रहेशे अने ते बाबतनी नोंध पोताना स्टेशननी ड्युटीबुकमां तेमज कंट्रोलरुमने करवानी रहेशे.
 - १२ दरेक सब ओझीसरे भ्रीशीग एपरेटस, लाईटीग जनरेटर, पोर्टबल पंप, शायर ऐन्ट्री/ प्रोट्रेक्शन शुट जेवा विशिष्ट साधनोनु टेस्टीग जाते करवानु रहेशे. अथवा रुबरु हाजर २८ जमादार, ड्राईवर-कम-पंप-ओपरेटर अने शायरमेन पासे कराववानु रहेशे.

सीनीयर वायरलेस ओझीसर :-

- १ सुरत भाजनगरपालिकानी सब - ओडिनेट केडरनां तमाम वायरलेस ओझीसर तथा तेने संलग्न स्टाफनी कामगीरीनु भोनीटरीग करवुन्.

- ૨ ફાયરખાતામાં વાયરલેસ ઓફીસર તરીકે ફરજ બજાવતા કર્મચારીએ તેમની નિમણું કે ફાયર સ્ટેશન ઉપર કરવામાં આવેલ હોય તે સ્ટેશન ઉપર તેમજ વાયરલેસ કંદ્રોલરૂમમાં ડે.ચીફ ફાયર ઓફીસર તેમજ ચીફ ફાયર ઓફીસરની સીધી દેખરેખ હેઠળ ચોવીસ કલાકની ફરજ બજાવવાની રહેશે.
- ૩ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસનાં વાયરલેસ કોમ્યુનિકેશન સેક્શનની તમામ વહીવટી કામગીરીનું મોનીટરીંગ કરવું તથા તે મુજબની કામગીરીની વહેંચણી કરવી.
- ૪ હેડ કવાર્ટસના ટેલીફોન ઓપરેટરની કામગીરીનું મોનીટરીંગ કરવું તેમજ સુરત મહાનગરપાલિકાનાં ઈન્કવાયરી ટેલીફોન અન્ય વિભાગ અને ટેલીફોન ઓપરેટરની બોર્ડ તેમજ હેલ્પલાઈન ઉપર આવતા કોલ બાબતે કામગીરીનું સંકલન કરવું.
- ૫ ભાતાના ઉપયોગ માટે જરૂર પડ્યે હોલે. જનરેટર માટે લાઇટ ની વ્યવસ્થા તેઓએ કરવાની રહેશે. સદર કામ માટે તમામ હોલે. જનરેટર ચાલુ અવસ્થામાં રહે તેની તકેદારી તેઓએ રાખવાની રહેશે.
જો કોઈ હોલે. જનરેટીંગ સેટ બંધ અવસ્થામાં હોય તો તે અંગેની લેખિત જાણ ડે.ચીફ ફાયર ઓફીસર અથવા ચીફ ફાયર ઓફીસરને કરવાની તેમજ તેવા બગડેલ જનરેટર તાકીએ રીપેર કરાવવાની સંપૂર્ણ જવાબદારી તેઓની રહેશે.
- ૬ સુરત મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ માટે જરૂરી હોય તેવા ઈમરજન્સી શોર્ટ કોડ નંબરની ફાળવણીની કામગીરીનું સંકલન કરવું (i.e. "112", "14420")
- ૭ સુરત મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ વિભાગ તેમજ આવશ્યક સેવાઓ પુરી પાડતા હાઈડેક્સિક / ડ્રેનેજ તેમજ આરોગ્ય વિભાગ તેમજ જોન કષાએ તેઓની જરૂરિયાત મુજબ વાયરલેસ કોમ્યુનિકેશન ઉપકરણોની વખતો વખત પ્રોક્યોર્મેન્ટની કામગીરી કરવી.
- ૮ આ ઉપરાંત વાયરલેસ ઓફીસરે પોતાનું કવાર્ટસ તેમજ કંદ્રોલરૂમ છોડતા પહેલા ડે.ચીફ ફાયર ઓફીસર કે તેનાથી ઉપલી અધિકારીની મંજુરી મેળવવાની રહેશે. અને તે મુજબ ની જાણ ડે.ચીફ ફાયર ઓફીસર, ચીફ ફાયર ઓફીસર તેમજ કંદ્રોલરૂમ ને કરવાની રહેશે.
- ૯ વાયરલેસ કોમ્યુનિકેશન તેમજ લેન્દલાઈન અને એક્ષટેન્શન નંબરોની સર્વિસ માટે જરૂરી એસેસરીઝ અને સ્પેરપાર્ટ્સ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ તેમજ અન્ય વિભાગોને ઉપલબ્ધ કરાવવા.
૧૦. સબ ઓડિનેટ કેડરના વાયરલેસ ઓફીસર તેમજ ટેલીફોન કષાના ટેલીફોન ઓપરેટરો અને ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના અધિકારીશ્રી કર્મચારીઓ માટે કોમ્યુનિકેશન ઉપકરણોની વખતો વખત તાલીમ ગોઠવવી તેમજ કોમ્યુનિકેશન સર્વિસના ઉપયોગ બાબતે સુદૃઢ વ્યવસ્થા ગોઠવવી.
૧૧. સુરત મહાનગરપાલિકાના એનાલોગ વાયરલેસ કોમ્યુનિકેશન સર્વિસનું ડીજીટલ વાયરલેસ કોમ્યુનિકેશન સર્વિસીસમાં ડ્રાન્સ્ફોર્મેશન કરવું તેમજ સમયાંતરે નવી કોમ્યુનિકેશન ટેકનોલોજીથી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસને અપગ્રેડ કરવું.
૧૨. ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસનાં જાહેર જનતાને આગ અકસ્માત ના સમયે અવેરનેશ તેમજ પ્રેક્ટીકલ તાલીમ આપતા "ફાયર વોલીયન્ટર પ્રોગ્રામ" માં સંકલન ની કામગીરી કરવી.
૧૩. વિવિધ ફાયર સ્ટેશનનો ખાતે CCTV ઈન્સ્ટોલ કરાવવા તેમજ ઈમરજન્સી વ્હીકલોમાં વ્હીકલ ટ્રેકીંગ સિસ્ટમ (VTS) ઈન્સ્ટોલ કરવા લાગત વિભાગો સાથે સંકલીત કરી ઉચ્ચ અધિકારીશ્રીઓની સુચના મુજબ કામગીરી કરવી.
૧૪. સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ ઉપર ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગને લગતી માહિતી વખતો વખત અપડેટ કરાવવી તેમજ ફાયર વિભાગને લગતી વિવિધ ફોર્મ નીતિનિયમો ને લગતી જાણકારી અપગ્રેડ કરવી.
૧૫. તાથા અધિકારી/કર્મચારીઓ શિસ્ત તેમજ ગણવેશમાં રહે તે મુજબ યોગ્ય ચકાસણી અને ખાતરી કરવી.

વાયરલેસ ઓફીસર :—

- ૧ ફાયરખાતાનાં જે જે વાહનો ઉપર વાયરલેસ (મોબાઇલ) સેટ મુકવામાં આવેલ છે. તેનું નિયમિત બે વખત ટેસ્ટીંગ કરવાનું રહેશે. તેમજ ખામી ભરેલ વાયરલેસ સેટ વિના વિલંબે રીપેર કરવાના રહેશે.

સદર બાબત કંદ્રોલરૂમ ખાતે રાખવામાં આવેલ મેઈન કંદ્રોલરોટ તેમજ આવશ્યકતાના સમયમાં કામચલાઉ ધોરણે

- ઉભા કરવામાં આવેલ સ્ટેટીક કંદ્રોલના સેટ માટે પણ લાગુ પડશે.
૨. વાયરલેસ ઓફીસરે કંદ્રોલરૂમ / ટેલીફોન રૂમના તમામ વિજળીક ઉપકરણોની નોંધ જે તે રજીસ્ટરમાં રાખવાની રહેશે. ઉપરાંત તમામ ઉપકરણોનું ટેસ્ટીંગ વિશેરે કરવા કરાવવાની સંપૂર્ણ જવાબદારી તેમની રહેશે.
 ૩. આ ઉપરાંત વાયરલેસ ઓફીસરે પોતાનું કવાર્ટ્સ તેમજ કંદ્રોલરૂમ છોડતા પહેલા ડે.ચીફ શાયર ઓફીસર ૨ કે તેનાથી ઉપલી અધિકારીની મંજુરી મેળવવાની રહેશે. અને તે મુજબ ની જાણ ડે.ચીફ શાયર ઓફીસર, ચીફ શાયર ઓફીસર ૨ તેમજ કંદ્રોલરૂમ ને કરવાની રહેશે.
 ૪. તમામ શાયર સ્ટેશનો, શાયર વિભાગનાં તમામ અધિકારીશીઓ તેમજ તમામ શાયર ફાઈટીંગ/ રેસ્ક્યુ વિકલોમાં ત્વરિત કોમ્પ્યુનિકેશન માટે વાયરલેસ સેટો 24 x 7 કંદ્રોલરૂમ સાથે સંકલનમાં રાખવા.
 ૫. શાયર એન્ડ ઈમરજન્સી સર્વિસના શાયર કંદ્રોલરૂમમાં અલાયદા વાયરલેસ સેટ તેમજ વોક્યુટોકીનું નેટવર્ક ગોઠવું.
 ૬. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની અસરકારક કામગીરી માટે Dy. MOH / ચીફ એસ.આઈ. તેમજ વોર્ડ કક્ષાએ અલાયદી ઝોન વાઈઝ વાયરલેસ ચેનલ શાળવી તેઓની જરૂરિયાત મુજબ વાયરલેસ સેટોનું નેટવર્ક ઉલ્લ કરી શાળવણી કરવી.
 ૭. સુરત મહાનગરપાલિકાના મા.કમિશનરશી તેમજ વિવિધ પદાધિકારીશી અને સ્ટેટીક/ મોબાઇલ તેમજ હેન્ડ હેન્ડ પ્રકારનાં વાયરલેસ કોમ્પ્યુનિકેશન ના ઉપકરણોની શાળવણી કરવી તેમજ તેનાં મરામત અને નિભાવ કરવા.
 ૮. સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગની રોજ બરોજની કામગીરી તેમજ વોર્ડ લેવલના ઈન્ફીકેશન માટે વોર્ડ ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન / પંખીગ સ્ટેશન / ઓવરહેડ ટાંકી/ ઈન્ફેક્શન / વોર્ડ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે તેઓની જરૂરિયાત મુજબ અલાયદા વાયરલેસ નેટવર્ક ચેનલ એસ્ટાબ્લિશ કરવી તેમજ તે પ્રમાણે વાયરલેસ સર્વિસ પુરી પાડવી.
 ૯. ડ્રેનેજ વિભાગના સુઅંગ ટ્રીટમેન્ટ પ્લાન્ટ / પંખીગ સ્ટેશન ઉપરાંત માર્કેટ વિભાગની ઢોર પકડવાની કામગીરી તેમજ ગ્રાણી સંગ્રહાલય / એકવેરીયમ / ઈન્ફોર સ્ટેડીયમ/ પર્ફોર્માંગ આર્ટ સેન્ટર/ ઓડીટોરીયમ ના પ્રોગ્રામ સમયે વ્યવસ્થા સંકલન માટે વાયરલેસ સર્વિસ પુરી પાડવી.
 ૧૦. વાવાઓડા તેમજ બારે વરસાદાના સમયે ગાઈન વિભાગ તેમજ શાયર એન્ડ ઈમરજન્સી સર્વિસની કામગીરી માટે કોમ્પ્યુનિકેશન નેટવર્ક એસ્ટાબ્લિશ કરવું.
 ૧૧. સુરત મહાનગરપાલિકાના મુજબ મથક તેમજ મા.કમિશનરશી તેમજ મેયરશીના સત્તાવાર નિવાસસ્થાને કોમ્પ્યુનિકેશન સર્વિસ હેતુસર EPABX સિસ્ટમ ઈન્ફોરોલ કરવી તેમજ તે સંબંધિત ફરિયાદોનું નિવારણ કરવું.
 ૧૨. સુરત મહાનગરપાલિકાની પ્રજાલક્ષી કામગીરીના સતત મોનીટરીંગ માટે નાઈટ રાઉન્ડમાં ઉચ્ચ અધિકારીશીઓની અસરકારક કામગીરી માટે શાયર કંદ્રોલરૂમ મારફત વાયરલેસ કોમ્પ્યુનિકેશન સર્વિસ ઉપલબ્ધ કરાવવી.
 ૧૩. શાયર એન્ડ ઈમરજન્સી સર્વિસના વિવિધ શાયર સ્ટેશનો ખાતે શાયર કંદ્રોલરૂમની કનેક્ટીવીટી માટે લેન્ડલાઈન ની કનેક્ટીવીટી આપવી.
 ૧૪. વિવિધ શાયર સ્ટેશનો તથા તમામ શાયર ઓફીસરોનેઆગ અક્સમાતના સમયે તેમજ રોજ બરોજની શાયર એન્ડ ઈમરજન્સી સર્વિસની કામગીરી ત્વરીત કોમ્પ્યુનિકેશન માટે સીમાર્કાર્ની શાળવણી કરી તેનો નિભાવ કરવો.
 ૧૫. શાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ માટે ૧૦૧/૧૦૨ જેવી ઈમરજન્સી લાઈન તેમજ અન્ય આવશ્યક સેવાઓ પુરી પાડતી સંસ્થાઓ જેવી કે, ઈલેક્ટ્રોનિક કંપની / ગેસ કંક્પની / ટ્રાન્ઝિક્ષન્સ પોલીસ વિભાગ સાથે હોટલાઈન સેવાઓ પુરી પાડવી.
 ૧૬. સુરત મહાનગરપાલિકાની ટોલ ફ્રી નંબરોની સર્વિસ શાળવણી તેમજ તેના ફોલ્ટ આવ્યેથી નિરાકરણ કરવું.

(પાછળ જુઓ)

૧૭. સુરત મહાનગરપાલિકા હેલ્પલાઈન વિવિધ કચેરીઓને તેઓની જરૂરિયાત મુજબ લેન્ડલાઈન કનેક્શનની શાળવણી કરવી.
૧૮. સુરત મહાનગરપાલિકાના હેડ કવાર્ટ્સની કચેરીઓના ઈન્ટરનલ કોમ્પ્યુનિકેશન માટે જરૂરિયાત મુજબ એક્સ્ટેન્શન નંબરોની શાળવણી કરી તેનું સંચાલન કરવું તથા એક્સ્ટેન્શન નંબરોની લાઈનમાં ફોલ્ટ આવ્યેથી તેની મરામત /

નિભાવની કામગીરી કરવી.

- ૧૯ સુરત મહાનગરપાલિકાનાં માન. કમિશનરશ્રીના / વિભાગીય વડાશ્રીઓ તેમજ પદાવિકારીઓને પ્રજાલક્ષી કામગીરી માટે
GSM સર્વિસના મોબાઇલ / સીમકાર્ડ ફાળવવા.
- ૨૦ સુરત મહાનગરપાલિકાનાં અધિકારીશ્રી / કર્મચારીઓને વિવિધ યોજના લક્ષી કામગીરી/ પુર- આંકૃત/ મહામારીના
સંજોગોમાં સીમકાર્ડ તથા ફીકસડ વાયરલેસ ટેલીફોન ફીકસડ સેલ્યુલર ટર્મિનલની સુવિધા ઉપલબ્ધ કરાવવા.

જમાદાર / માર્શિલ લીડર :-

- ૧ સદરકષામાં નિમણુંક પામેલ કર્મચારીએ પોતાની નિમણુંક તેમજ બદલી જે સ્ટેશન ઉપર કરવામાં આવેલ હોય તે સ્ટેશનનાં
જવાબદાર અધિકારી (સબ ઓફિસર, ફાયર ઓફિસર તેમજ અન્ય ઉચ્ચઅધિકારીશ્રી) ની દેખરેખ હેઠળ તેના આદેશ
પ્રમાણે પાણી પ્રથા મુજબ ખાતાકીય ફરજ બજાવવાની રહેશે તેમજ તમામ અધિકારીઓની સ્ટેશન ઉપરની ગેરહાજરી

દરમ્યાન સ્ટેશનનો વહીવટ સંબાળવાનો રહેશે.

- ૨ પોતાના તાબા હેઠળના ફાયરમેન, ડ્રાઇવરકમપંપઓપરેટર તેમજ શબ્દાહીની કલીનરોની દૈનિક ફરજો સૌખ્યવાની રહેશે.
- ૩ પોતાના તાબા હેઠળના કર્મચારીઓ ફરજ ઉપર મહાનગરપાલિકા તરફથી ફાળવવામાં આવેલ ગણવેશ સુવ્યવસ્થિતપણે પહેરે તેની નોંધ રાખવાની રહેશે. તેમજ જાતે પણ તેનું પાલન કરવાનું રહેશે.
- ૪ જવાબદાર અધિકારી નિયત કરે તે મુજબ આગ અકસ્માતના કોલમાં જવાનું રહેશે. તેમજ પહેલો ટર્નઆઉટ નો સ્ટાફ નક્કી કરવાનો રહેશે.
- ૫ તાબા હેઠળ ના કર્મચારીઓની દૈનિક હાજરી સવાર ના ૬:૦૦ થી ૨:૦૦ કલાક, ૨:૦૦ થી ૧૦:૦૦ કલાક, તેમજ ૧૦:૦૦ થી ૬:૦૦ કલાકે લેવાની રહેશે. તેમજ સવારના ૮:૦૦ કલાકે અને સાંજના ૫:૦૦ કલાકે, તેમજ અધિકારીશ્રીના આદેશ મુજબ પોતાના સ્ટેશન ઉપર રાખવામાં આવેલ સાધનો, વાહનો વિગેરેની સાફ સુફીની કરાવવાની રહેશે.
- ૬ તાબા હેઠળ નાં કર્મચારીઓ પોતાની ફરજ નિયમિતપણે બજાવે તેનું ધ્યાન રાખવાનું રહેશે. જો તેમાં ક્ષતિ જણાય તો અનુકૂળે સબ ઓફીસર, ફાયર ઓફીસર તેમજ અન્ય ઉચ્ચઅધિકારીને લેખિતમાં જાણ કરવાની રહેશે.
- ૭ આગ—અકસ્માતના કોલમાંથી પરત આવ્યા બાદ તેમજ સામાન્ય સંજોગોમાં તાબા હેઠળના ફાયર સ્ટેશનનાં વાહનો કે સાધનોમાં ક્ષતિ કે તુટી જણાય તો અનુકૂળ નં—૦૬ મુજબના અધિકારીઓને તાકીદ જાણ કરવાની રહેશે.
- ૮ તાબા હેઠળનાં સ્ટેશન વિસ્તારના હાઈસ્ટ્રોન્ટ તાબા હેઠળનાં ફાયરમેન મારફત ચેક કરાવવાનાં રહેશે ખામી લર્યા હાઈસ્ટ્રોન્ટનો લેખિત રીપોર્ટ જવાબદાર અધિકારીને કરવાનો રહેશે.
- ૯ ખાતાની દૈનિક પરેડમાં જાતે તેમજ તાબા હેઠળના કર્મચારીઓને નિયત ક્રમે હાજર રાખવાનો તેમજ પરેડ કરવા કરાવવાની રહેશે.
- ૧૦ કોઈપણ કારણસર પોતાનું ફાયર સ્ટેશન છોડતાં પહેલા જવાબદાર અધિકારી ને તે બાબતની જાણ કરવાની રહેશે.
- ૧૧ આગનાં કોલ માંથી પરત આવ્યા બાદ ફાયર ફાઈટીંગ યુનિટોમાં પાણી ભરાવવાની તેમજ અન્ય અર્થનશામક સાધનો સુવ્યવસ્થિત રાખવાની જવાબદારી જે તે જમાદાર ની રહેશે.

ડ્રાઇવર :-

- ૧ ડ્રાઇવર કમ પંપ ઓપરેટર તરીકે ફરજ બજાવતા કર્મચારીએ પોતાની નિમણુંક તેમજ બદલી જે ફાયર સ્ટેશન ઉપર કરવામાં આવેલ હોય તે સ્ટેશનનાં જમાદાર, સબ ઓફીસર કે ફાયર ઓફીસરની સીધી દેખરેખ હેઠળ પોતાને જે

ખાતાકીય વાહન ફાળવવામાં આવેલ હોય તેની ઉપર પાણી પ્રથા મુજબ ફરજ બજાવવાની રહેશે.

- ૨ પોતાને ફાળવવામાં આવેલ વાહનમાં બળતણ તેમજ વાહનને લગતી અન્ય સાધન સામગ્રી જેવા સ્પેરબ્લીલ , વિવિધ સ્પેનર વિગેરેની ચકાસણી રાખવી. વાહનના રેડિયેટરનું પાણી નિયમિત ચેક કરવું વાહનની વિવિધ લાઈટ બ્રેક તેમજ પંથી યુનિટ હોય તો તેની પંપ ઓઈલ વિગેરે નિયમિતપણે ટેસ્ટ તેમજ ચેક કરવા કરાવવાની સંપુર્ણ જવાબદારી ડ્રાઇવરની રહેશે.
- ૨.૧ એમ્બ્યુલન્સના ડ્રાઇવરે પોતાની એમ્બ્યુલન્સની નિયમિત સાફ- સફાઈ કરવાની રહેશે તેમજ એક વધારાનું સ્ટ્રેચર એમ્બ્યુલન્સમાં રાખવાનું રહેશે. આ ઉપરાંત ફર્સ્ટ-એઈડ બોક્સ (જરૂરી દવાઓ સાથે) રાખવાનું રહેશે તેમજ શબવાહીનીના ડ્રાઇવરે શબવાહીનીની નિયમિત સફાઈ કરવાની રહેશે. અને અઠવાડીયામાં ઓછામાં ઓછા એક વખત તેમજ જરૂર જણાયે શબવાહીને પાણીથી ધોઈ ફિનાઈલ થી જંતુરહિત કરી ફીટીથી પાણીથી ધોવાની રહેશે અને તે મુજબ ની નોંધ જે તે વાહન ની લોગબુકમાં રાખવાની રહેશે.
- ૩ પોતાની ફરજ દરમ્યાન મહાનગરપાલિકા તરફ થી ફાળવવામાં આવેલ ગણવેશ અચુકપણે પહેરવાનો રહેશે તેમજ સવારના ૮.૦૦ કલાકે અને સાંજના ૫.૦૦ કલાકે સ્ટેશન વર્કીંગમાં હાજર થઈ વાહનોનું ટેસ્ટીંગ કરવા—કરાવવાનું રહેશે.
- ૪ આગ અક્સમાતના કોલમાંથી પરત આવ્યા બાદ પોતાના તાબા હેઠળના વાહનમાં બળતણ, ઓઈલ વિગેરેની ચકાસણી કરવાની રહેશે. અને તે અંગે જો કોઈ ક્ષતિ જણાય તો જવાબદાર અધિકારીને તે બાબતની જાણ કરવાની રહેશે.
- ૫ ખાતામાં ચાલતી દૈનિક પરેડમાં જવાબદાર અધિકારીના આદેશ મુજબ હાજર થઈ પરેડ કરવાની રહેશે.
- ૬ પોતાના તાબા હેઠળનાં વાહનોની લોગબુક રોજબરોજ વિગતવાર ભાઈતી સાથે ભરવી સંજોગવસાત પોતાના તાબા હેઠળનાં વાહનો ચાર્જ અન્ય ડ્રાઇવરને આપવાનો થાય તેવા પ્રસંગોમાં લોગબુક ની સંપુર્ણ એન્ટ્રી કમ્પ્લીટ કરીને વાહન સાથે લોગબુક તેમજ એમ્બ્યુલન્સ શબવાહીની ના ટિક્સ્સામાં રસીદબુક અને વર્દીના નાણાં હોય તો તેની પણ ચાર્જ લેનાર ડ્રાઇવર કમ પંપ ઓપરેટર અથવા જે તે સ્ટેશનના જવાબદાર અધિકારીને સૌંપણી કર્યા બાદ વાહન ઉપર થી ધૂયા થતું.
- ૭ ફાયર ખાતાનાં દરેક ડ્રાઇવરે ફાયર પંપ ઓપરેશન, ઈમરજન્સી ટેન્ડરમાં રાખવામાં આવેલ સાધનોનું સંચાલન, જનરેટર, પોર્ટબલ પંપ વિગેરેનું ઓપરેશન ફરજીયાત પણે શીખવાનું રહેશે. તેમજ અધિકારીશ્રીની સૂચના મુજબ કામગીરી કરવાની રહેશે.

ફાયરમેન / માર્શલ :-

- ૧ સદરકક્ષામાં નિમણુંક પામેલ કર્મચારીએ પોતાની નિમણુંક તેમજ બદલી જે સ્ટેશન ઉપર કરવામાં આવેલ હોય તે સ્ટેશનનાં જવાબદાર અધિકારી (જમાદાર, સબ ઓફિસર તેમજ અન્ય ઉચ્ચઅધિકારી) ની દેખરેખ હેઠળ તેના આદેશ પ્રમાણે પાણી પ્રથા મુજબ ખાતાકીય ફરજ બજાવવાની રહેશે.

- ૨ જવાબદાર અધિકારી (જમાદાર, સબ ઓફિસર, ફાયર ઓફિસર) એ નિયત કરેલ ક્રમ મુજબ આગ અકસ્માતના કોલમાં ફરજીયાતપણે જવાનું રહેશે.
- ૩ જવાબદાર અધિકારીએ નિયત કરેલ ક્રમ મુજબ ખાતાની એમ્બ્યુલન્સ ઉપર ફરજ બજાવવાની રહેશે.
- ૪ જવાબદાર અધિકારી ગોઠવણ કરેલ હોય તે મુજબ જે તે ફાયર સ્ટેશન ઉપર પહેરા ડ્યુટી, ટેલિફોન ડ્યુટી, ટપાલ ની વહેચણી, ડેનિક પરેડ તેમજ જવાબદાર અધિકારીના આદેશ મુજબ ખાતાકીય અન્ય ફરજી બજાવવાની રહેશે.
- ૫ પોતાના સ્ટેશન ચાલુ ફરજ નાં સમયે સવારનાં ૮.૦૦ કલાકે તેમજ સાંજના ૫.૦૦ કલાકે સ્ટેશન નાં વર્કિંગમાં છાજર રહી સ્ટેશન ઉપર રાખવામાં આવેલ સાથનો, વાહનો વિગેરેની સાફ્સુફીની તેમજ જવાબદાર અધિકારીના આદેશ મુજબની ફરજી બજાવવાની રહેશે.
- ૬ પોતાની પહેરા ડ્યુટી, ટેલિફોન ડ્યુટી, દરમ્યાન પોતાના સ્ટેશનનું વાહન ફાયર સ્ટેશન છોડી બહાર જાય તો તેની નોંધ તાબા હેઠળના રજીસ્ટ્રેન્ચમાં કરવી તેમજ પોતાના સ્ટેશનના જવાબદાર અધિકારીને ફાયરખાતાના કંટ્રોલરૂમને અવશ્ય કરવી.
- ૭ પોતાની પહેરા ડ્યુટી, ટેલિફોન ડ્યુટી, દરમ્યાન પોતાના સ્ટેશનનું વાહન ફાયર સ્ટેશન છોડી બહાર જાય તો તેની નોંધ તાબા હેઠળના રજીસ્ટ્રેન્ચમાં કરવી તેમજ પોતાના સ્ટેશનના જવાબદાર અધિકારીને ફાયરખાતાના કંટ્રોલરૂમને અવશ્ય કરવી.
- ૮ પોતાના ફાયર સ્ટેશનના વિસ્તારના ફાયર હાઈડ્રોન જવાબદાર અધિકારીના આદેશ મુજબ ચેક કરવાના રહેશે. અને ખાતાકીય હાઇડ્રોનનો રીપોર્ટ કરવાનો રહેશે.
- ૧૦ કોઈપણ કારણસર પોતાનું ફાયર સ્ટેશન છોડતાં પહેલા જવાબદાર અધિકારી ને તે બાબતની જાણ કરવાની રહેશે.

શબવાહીની કર્ત્વાનિર :—

- ૧ શબવાહીની કર્ત્વાનિર તરીકે નિમણુંક પામેલા કર્મચારીઓ પોતાની નિમણુંક તેમજ બદલી જે ફાયર સ્ટેશન ઉપર કરવામાં આવેલ હોય તે સ્ટેશનના જમાદાર, સબ ઓફિસર કે ફાયર ઓફિસર ની સીધી દેખરેખ હેઠળ પાણી ગ્રથા મુજબ ફરજ બજાવવાની રહેશે.
- ૨ પોતાનાં ફાયર સ્ટેશન નાં જવાબદાર અધિકારી કે ખાતાના અન્ય ઉચ્ચાધિકારી જે શબવાહીની ની ઉપર ખાતાકીય ફરજ સોપે તેનું નિયમિતપણે પાલન કરવાનું રહેશે.
- ૩ પોતાની ફરજ ઉપર ભાગનગરપાલિકા તરફથી ફાયરવામાં આવેલ ગણવેશ અચુકપણે પહેરવાનો રહેશે.
- ૪ પોતે જે શબવાહીની ઉપર ફરજ બજાવતા હોય તે શબવાહીની સાફ સુફીની તમામ જવાબદારી જે તે શબવાહીની કર્ત્વાનિર ની રહેશે.
- ૫ તાબા હેઠળ ના કર્મચારીઓની ડેનિક હાજરી સવાર ના ૬:૦૦ થી ૨:૦૦ કલાક, ૨:૦૦ થી ૧૦:૦૦ કલાક, તેમજ ૧૦:૦૦ થી ૬:૦૦ કલાકે લેવાની રહેશે. તેમજ સવારના ૮.૦૦ કલાકે અને સાંજના ૫.૦૦ કલાકે, તેમજ અધિકારીશ્રીના આદેશ મુજબ પોતાના સ્ટેશન ઉપર રાખવામાં આવેલ સાથનો, વાહનો વિગેરેની સાફ સુફીની કામગીરી કરવાની રહેશે.
- ૬ કોઈપણ કારણસર ફાયર સ્ટેશન છોડતાં પહેલા જવાબદાર અધિકારીને તે બાબતની જાણ કરવાની રહેશે.

ફાયર એન્ડ સર્વિસીસ વિભાગના વહીવટી કચેરીના કર્મચારીઓની કામગીરીની વિગતો દર્શાવતું પત્રક.

૩. એકાઉન્ટન્ટ :— (કુલ-૧)

દિસાબીને લગતી તમામ કામગીરી, — બજેટ, જનરલ એડવાન્સ, ડિપોઝીટ, આવક— ખર્ચને લગતી તમામ કામગીરી, — ઓડિટ ઓફ્ઝેક્શનનો નિકાલ, — રીકુપમેન્ટની કામગીરી, — ઈન્ફીમેન્ટનાં અભિપ્રાયની કામગીરી. —પોતાના હાથ નીચેના કર્મચારી/કમદારની કામગીરીનું અસરકારક નિયંત્રણ તથા હાજરી નિયંત્રણ.

સેક્શન ઓફીસરઃ— (કુલ-૧).

ખાતાના મહેકમને લગતી તેમજ અન્ય ખાતા સાથે સંકલનને લગતી વહીવટી કામગીરી, ખાતાના કોર્ટ કેસની કામગીરી, શિક્ષાત્મક કાર્યવાહી કરવી. જૂના રેકર્ડનું વર્ગીકરણ કરી રેકર્ડ વિભાગને જમા કરવાની કામગીરી.

આસી. એકાઉન્ટન્ટ :— (કુલ - ૧)

ખાતાનાં રેવન્યુ, કેપીટલ તથા પર્સનલ એડવાન્સ બીલો તેમજ કેપીટલ અને રેવન્યુ બજેટ તૈયાર કરવાની કામગીરી.

પ્રથમ શ્રેષ્ઠી કલાર્ક :— (કુલ-૩)

આરટીઆઈ રજીસ્ટર નિભાવવી તેના સંલંઘન તમામ કામગીરીઓ, પર્સનલ એડવાન્સને લગતી કામગીરી, ઈએમડી/એસડીની કામગીરી, જનરલ એડવાન્સ રીક્વુપમેન્ટની કામગીરી. બજેટ અંગેની કામગીરી. ઓડીટ ઓફ્ઝિસલાઈન કામગીરી. ઈન્કમટેક્ષના ફોર્મ ચેક કરવા.

બીજી શ્રેષ્ઠી કલાર્ક :— (કુલ-૪)

(૧) અને (૨) એસ્ટાભ્લીશમેન્ટને લગતી કામગીરી, પેન્શન ગ્રેજ્યુઇટીને લગતી કામગીરી, ઈન્કમટેક્ષના ફોર્મની ડેટા એન્ટ્રી કરવી.

ત્રીજી શ્રેષ્ઠી કલાર્ક :— (કુલ -૧૦)

(૧) એસ્ટાભ્લીશમેન્ટને લગતી કામગીરી, પેન્શન ગ્રેજ્યુઇટીને લગતી કામગીરી, હુલીકેટ સેવાપોથી લખવી.

(૨) કોન્ટ્રાક્ટ હેઠળના એભ્યુલન્સ/શબ્દવાહીનીના અને અધિકારી/પદાધિકારીશ્રીને ફાળવેલ વાહનોના માસિક બીલોની ચૂકવણી કરવી. ચેરમેન/પદાધિકારીશ્રીના અંગત કામે વાહનો વપરાશના બીલો બનાવવા.

લેન્દલાઈન ટેલીફોનના માસિક બીલો બનાવી ચૂકવણીની કામગીરી, ટેલીફોન બોર્ડની રીપેરીંગ, મેઇનટેનાન્સની કામગીરી. અધિકારી/પદાધિકારીશ્રીઓના ટેલીફોન કમ્પ્લેનની કામગીરી. ટેન્ડર ઓપન કરાવવા. સેન્ટ્રલ સ્ટોરમાંથી માલસામાન લાવવો. વાર્ષિક સ્ટેશનરી છપાવવી. સ્ટેશનરી/રજીસ્ટર છપાવવા તેમજ પ્રેસ અને રેકર્ડ વિભાગમાં નંબરીંગ કરી સીલ કરવાની કામગીરી. ઈન્કમટેક્ષના ફોર્મની ડેટા એન્ટ્રી કરવી.

(૩) ડિસ્પેચ (આઉટવર્ક / ઈનવર્ક)ની કામગીરી

(૪) લાઈટબીલ બનાવવા, રસીદલુક ઈસ્યુ કરવાની કામગીરી, અધિકારી/કર્મચારીઓના ટી.એ.ડી.એ. ના બીલો બનાવવાની કામગીરી, રસીદ બનાવવી, બરણું કરવું.